

શુલ્કનું સમયપત્રક ઢ ઇક્વિટાસ પ્રિફર્ડ સેલરી એકાઉન્ટ (૦૧ જૂન, ૨૦૨૫ થી અમલમાં)

સરેરાશ માસિક બેલેન્સ (AMB)	
સરેરાશ માસિક બેલેન્સ (AMB)	શૂન્ય
AMB બન-જાળવણી શુલ્ક	શૂન્ય
ડેબિટ કાર્ડ	
ડેબિટ કાર્ડનો પ્રકાર**	રૂપે પ્લેટિનમ ડેબિટ કાર્ડ વિઝા પ્લેટિનમ ડેબિટ કાર્ડ
ડેબિટ કાર્ડ જારી અને ફરી જારી કરવાના શુલ્ક	મફત
વાર્ષિક જાળવણી અને નવીકરણ શુલ્ક	મફત
ઉધારણી	
સ્થાનિક ચેક ક્લિયરિંગ	મફત
બેંક ખાતે અન્ય બેંકના ચેક કલેક્શનનું શુલ્ક	૫૦૦૦ રૂપિયા સુધીના શુલ્ક રૂ.૨૫, ૫૦૦૦ થી વધુ અને રૂ.૧૦,૦૦૦ સુધીના શુલ્ક રૂ.૫૦/-, રૂ.૧૦,૦૦૦ થી વધુ અને
બેંક સિવાયના અન્ય સ્થળોએ અન્ય બેંક ચેક કલેક્શનનું શુલ્ક	રૂ.૧૦૦૦૦૦ સુધીના શુલ્ક રૂ.૧૦૦/-, રૂ.૧૦૦૦૦૦ થી વધુના શુલ્ક રૂ.૧૫૦/-
RTGS ઇનવર્ડ/NEFT ઇનવર્ડ/IMPS ઇનવર્ડ	મફત
ફોરેન ઇનવર્ડ રેમિટન્સ	મફત
ચુક્વણી	
ઇક્વિટાસ બેંકની શાખાએ ડિમાન્ડ ડ્રાફ્ટ અને પેઓર્ડર	ESFB સ્થાને જારી થયેલ ત્રિમાસમાં ૧૫ ડીડી સુધી મફત
મફત મર્યાદાથી વધુ પર શુલ્ક	પ્રતિ ડીડી રૂ. ૫૦
ઇક્વિટાસ બેંકની શાખા સિવાયના સ્થળોએ ડિમાન્ડ ડ્રાફ્ટ	પ્રતિ ડીડી રૂ. ૧૦૦
PAP ચેક વડે ચુક્વણી	મફત
શાખાએ RTGS અને NEFT આઉટવર્ડ (મફત ઓનલાઇન)	NEFT: રૂ. ૧૦૦૦૦/- સુધી રૂ. ૨.૨૫, રૂ. ૧૦૦૦૧ થી રૂ. ૧૦૦૦૦૦ સુધી: રૂ. ૪.૫, રૂ. ૧૦૦૦૦૦ થી રૂ. ૨૦૦૦૦૦ સુધી: રૂ. ૧૪.૫, રૂ. ૨૦૦૦૦૦ થી રૂ. ૫૦૦૦૦૦૦ સુધી: રૂ. ૨૪.૫. RTGS: રૂ. ૨૦૦૦૦૦ થી રૂ. ૫૦૦૦૦૦૦ સુધી: રૂ. ૨૦, રૂ. ૫૦૦૦૦૦૦ થી વધુ: રૂ. ૪૦.
IMPS આઉટવર્ડ (દિવસ દીઠ મર્યાદા ૫,૦૦,૦૦૦/-)	૫૦૦૦૦૦ રૂપિયા સુધી: રૂ.૨.૫/-, રૂ. ૫૦૦૦૦૦- રૂ. ૧ લાખ: રૂ.૫/-, રૂ. ૧ લાખથી વધુ: રૂ.૭.૫/-
ચેક બુક	દર ત્રણ મહિને ૧૫ લીફ મફત
મુક્ત મર્યાદાથી વધુ શુલ્ક	પ્રતિ લીફ રૂ. ૨૫
રોકડ શુલ્ક	
સંયુક્ત રોકડ જમાની મર્યાદા (રહેઠાણ અને બિન-રહેઠાણ)	૨૦૦,૦૦૦ રૂપિયા સુધી ૫ વ્યવહારો મફત
મફત મર્યાદાથી વધુ પર શુલ્ક	૧૦૦૦ દીઠ રૂ. ૫
સંયુક્ત રોકડ ઉપાડની મર્યાદા (રહેઠાણ અને બિન-રહેઠાણ)	મફત અમર્યાદિત
ઇક્વિટાસ એટીએમ પર ડેબિટ કાર્ડ વડે રોકડ ઉપાડના વ્યવહારો	મફત અમર્યાદિત
અન્ય એટીએમ પર ડેબિટ કાર્ડ વડે રોકડ ઉપાડના વ્યવહારો (નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો)	૩ મેટ્રો/શહેરી સ્થળ અને ૫ અર્ધ-શહેરી/ગ્રામીણ સ્થળ
એટીએમ ઉપાડની મફત મર્યાદાથી વધુ શુલ્ક	પ્રતિ નાણાકીય વ્યવહાર રૂ. ૨૩/-, ૧૨ રૂપિયા પ્રતિ બિન-નાણાકીય વ્યવહાર
નોન-ઇક્વિટાસ એટીએમનો ઉપયોગ - અપૂરતા ભંડોળને કારણે રોકડ ઉપાડ નક્કાર્યું	રૂ. ૧૦/- પ્રતિ વ્યવહાર
ભારતની બહાર રોકડ ઉપાડ	રૂ. ૧૧૦/- પ્રતિ વ્યવહાર
ભારતની બહાર બેલેન્સની પૂછપરછ	રૂ. ૨૫/- પ્રતિ વ્યવહાર
અન્ય શુલ્ક	
એટીએમ ઉપાડની મર્યાદા	૫૦,૦૦૦ રૂપિયા પ્રતિ દિવસ
પીઓએસ / ઇ-કોમર્સ મર્યાદા	૧૦૦,૦૦૦ રૂપિયા પ્રતિ દિવસ
કાર્ડ વડે વ્યવહારની સ્લિપની પુનઃપ્રાપ્તિના શુલ્ક	રૂ. ૨૫૦/- પ્રતિ સ્લિપ
રવોપ પેમેન્ટ સિંગલ ચેક	રૂ. ૧૦૦/- પ્રતિ ચેક
રવોપ પેમેન્ટ સિરીઝ	૨૫ ચેકની સિરીઝ માટે રૂ. ૧૫૦/-
નાણાકીય કારણોસર આઉટવર્ડ ચેક રીઝર્વના શુલ્ક	રૂ. ૭૫/- પ્રતિ ચેક
ટેક્નિકલ કારણોસર આઉટવર્ડ ચેક રીઝર્વના શુલ્ક	શૂન્ય
નાણાકીય કારણોસર ઇનવર્ડ ચેક રીઝર્વના શુલ્ક	૨ ચેક સુધી રૂ. ૫૦૦ થી, ત્રીજો ચેક રૂ. ૭૫૦/- થી
ટેક્નિકલ કારણોસર ઇનવર્ડ ચેક રીઝર્વના શુલ્ક	શૂન્ય

સ્થાયી સૂચનાઓ સેટઅપ / સુધારો (RD / SIP / બિલ ચુકવણી માટે મફત)	રૂ. ૨૫/- પ્રતિ વખત
સ્થાયી સૂચનાઓ નિષ્કળતા (રીઝર્વ)	પ્રતિ રિઝર્વ રૂ. ૧૫૦/-
નાણાકીય ક્ષરણોસર ECS રિઝર્વ	પ્રતિ રિઝર્વ રૂ. ૨૦૦/-
SMS ચેતવણીઓ (ડેબિટ અને ક્રેડિટ વ્યવહારો)	પ્રતિ મહિને ૧૦ મફત SMS. ત્યારબાદ, પ્રતિ જખજ ૩૦ પૈસા
ફોરેન એક્સચેન્જ માર્ક-અપ [^]	૩.૫%
પ્રમાણપત્ર અને રિપોર્ટ જારી કરવું	
બેલેન્સ પ્રમાણપત્ર શાખા (ઓનલાઇન મફત)	પ્રતિ વખત રૂ. ૨૫૦/-
પાછલા વર્ષની બેલેન્સ અને વ્યાજનું સ્ટેટમેન્ટ (ઓનલાઇન મફત)	દર વર્ષે ૧ મફત, ૧ થી વધુ પ્રતિ સ્ટેટમેન્ટ રૂ. ૩૦૦/-
પાસબુક જારી કરવી	મફત
સહીની ચકાસણી પ્રમાણપત્ર / ફોટો પ્રમાણિત / સરનામાની પુષ્ટિ	પ્રતિ વખત રૂ. ૫૦
ડ્રુપ્સિકેટ TDS પ્રમાણપત્ર	રૂ. ૧૦૦/-
ડ્રુપ્સિકેટ એક્સઉન્ટ સ્ટેટમેન્ટ પ્રિન્ટ (મફત ઓનલાઇન અથવા ઇમેઇલ પર)	રૂ. ૫૦/-
DD/PO પુનઃમાન્યીકરણ / રદ્દીકરણ	રૂ. ૧૦૦/-
ખાતું ખોલ્યાના ૧૫ દિવસ પછી અને ૬ મહિના પૂર્ણ કરતા પહેલા ગ્રાહકની વિનંતી પર બંધ કરવામાં આવે તો ખાતું બંધ કરવાના શુલ્ક	રૂ. ૫૦૦
ખાતું નિષ્ક્રિય રહેવા પર શુલ્ક	શૂન્ય
ઝેરસ્ટેપ બેંકિંગ ^{##}	
ચેક પિકઅપ	પ્રતિ વખત રૂ. ૫૦
કેશ પિકઅપ બીટ (દર મહિને શુલ્ક)	
રૂ. ૨,૦૦,૦૦૦ સુધી	રૂ. ૩૫૦૦
૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦	રૂ. ૫૦૦૦
૫,૦૦,૦૦૦ થી ૧૦,૦૦,૦૦૦	રૂ. ૧૦૦૦૦
૧૦,૦૦,૦૦૦ થી વધુ	શાખાનો સંપર્ક કરો
બોલ પર કેશ પિકઅપ (દરેક વખતે શુલ્ક)	
રૂ. ૨૦૦૦૦૦ સુધી	રૂ. ૧૫૦/-
૨૦૦૦૦૦ થી ૫૦૦૦૦૦	રૂ. ૩૦૦/-
૫૦૦૦૦૦ થી ૧૦૦૦૦૦૦	રૂ. ૫૦૦/-
૧૦૦૦૦૦૦ થી ૨૦૦૦૦૦૦	રૂ. ૮૦૦/-
રૂ. ૨૦૦૦૦૦ સુધી	શાખાનો સંપર્ક કરો

લાગુ પડતા કુ વધારાના રહેશે. કમ્ડ= પેમેન્ટલ એટ પાર ગમ: લાગુ પડતું નથી જમ: સેવિંગ્સ એક્સઉન્ટ
* નાણાકીય વ્યવહાર તરીકે ગણવામાં આવતા અપૂરતા ભંડોળને કારણે રોકડ ઉપાડ નિષ્ફળ

****ELITE** ડેબિટ કાર્ડ ફક્ત **ELITE** ગ્રાહકોને જ જારી કરવામાં આવે છે, જો ગ્રાહક પાસે હવે **ELITE** પ્રોગ્રામ સ્ટેટસ ન હોય તો ૬૦૦ રૂપિયા શુલ્ક લાગુ પડશે (શુલ્ક ટાળવા માટે રિપ્લેસમેન્ટ ડેબિટ કાર્ડ માટે કન્ટ્રમર કેર/ શાખાનો સંપર્ક કરો)
[^] સેવાઓ ફક્ત પસંદગીની શાખાઓ પર જ ઉપલબ્ધ છે. ભારતમાં; ન્યૂનતમ મૂલ્ય રૂ. ૫૦,૦૦૦; અને મહત્તમ મૂલ્ય રૂ. ૨,૦૦,૦૦૦
[^] ભારતીય ચલણમાં, આંતરરાષ્ટ્રીય સ્થાન પર અથવા ભારતમાં કાર્યરત પરંતુ વિદેશી રાષ્ટ્રમાં નોંધાયેલા વેપારીઓ સાથે ભારતીય ચલણમાં કરવામાં આવતા દરેક આંતરરાષ્ટ્રીય વ્યવહાર પર ૩.૫% ફોરેક્સ માર્ક-અપ ફી (લાગુ પડતા કુ) વસૂલવામાં આવશે. આ ઇખજમ ખાતા હેઠળ જારી કરાયેલા તમામ ડેબિટ કાર્ડ્સ માટે લાગુ પડે છે, સિવાય કે ઊદ્યોગિક (માસ્ટરકાર્ડ વર્લ્ડ) અને ગણુજા (વિઝા પ્લેટિનમ). કૃપા કરીને નોંધ લો કે બેંકની વિવેકબુક્કિના આધારે આ સમયાંતરે બદલાઈ શકે છે.